

નં.જિપંક/મકમ/સમિતિ/જાહેરાત/૨૦૧૭

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ

જિલ્લા પંચાયત કચ્છ-ભુજ

તા.૨૩/૧/૨૦૧૭

પ્રતિ,

નાયબ માહિતી નિયામકશ્રી

માહિતી ખાતુ

ભુજ-કચ્છ

વિષય :- જાહેરાત પ્રસિધ્ધ કરવા બાબત.

સવિનય જયભારત સાથે ઉક્ત વિષય અન્વયે જણાવવાનું કે, કચ્છ જિલ્લામાં ભરતી પ્રક્રિયા ૨૦૧૭ અંતર્ગત આપવાની થતી જાહેરાત ૩(ત્રણ) નકલમાં આ સાથે સામેલ છે. આ જાહેરાત રાજ્યના તમામ જિલ્લાના વર્તમાન પત્રમાં પણ પ્રસિધ્ધ થાય તે મુજબ બહોળી પ્રસિધ્ધી ધરાવતા દૈનિક વર્તમાન પત્રમાં પ્રસિધ્ધ થવા વિનંતી છે.

સચિવ

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ

કચ્છ-ભુજ

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ભુજ-કચ્છ

સ્પર્ધાત્મક પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ભુજ-કચ્છની આગામી ફેબ્રુઆરી ૨૦૧૭ માસમાં જાહેરાત ક્રમાંક DPSSCO૧/૨૦૧૬-૧૭/૧ થી ૫/૨૦૧૬-૧૭ની વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે જે તે સંવર્ગની સામે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક(કોલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઈટ <https://ojas.gujarat.gov.in> ઉપરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી મેળવી લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.

જાહેરાત ક્રમાંક અને સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ	પરીક્ષાનો સમય	કોલેટર/હોલ ટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો	
			From	To
DPSSCO૧/૨૦૧૬-૧૭/૨ તલાટી કમ મંત્રી	તા.૧૨-૨-૨૦૧૭ રવિવાર	૧૧.૦૦ થી ૧૨.૦૦	૨૫-૧-૨૦૧૭ ૧૫.૦૦	૧૨-૨-૨૦૧૭ ૧૧.૦૦
DPSSCO૧/૨૦૧૬-૧૭/૩ મલ્ટી પરપઝ હેલ્થ વર્કર(પુ.)	તા.૧૨-૨-૨૦૧૭ રવિવાર	૧૫.૦૦ થી ૧૬.૦૦	૨-૨-૨૦૧૭ ૧૫.૦૦	૧૨-૨-૨૦૧૭ ૧૫.૦૦
DPSSCO૧/૨૦૧૬-૧૭/૫ ગ્રામસેવક	તા.૧૮-૨-૨૦૧૭ શનિવાર	૧૬.૦૦ થી ૧૭.૦૦	૮-૨-૨૦૧૭ ૧૫.૦૦	૧૮-૨-૨૦૧૭ ૧૬.૦૦
DPSSCO૧/૨૦૧૬-૧૭/૧ જુનીયર ક્લાર્ક	તા.૧૯-૨-૨૦૧૭ રવિવાર	૧૧.૦૦ થી ૧૨.૦૦	૧-૨-૨૦૧૭ ૧૫.૦૦	૧૯-૨-૨૦૧૭ ૧૧.૦૦
DPSSCO૧/૨૦૧૬-૧૭/૪ ફિમેલ હેલ્થ વર્કર(સ્ત્રી)	તા.૧૯-૨-૨૦૧૭ રવિવાર	૧૫.૦૦ થી ૧૬.૦૦	૯-૨-૨૦૧૭ ૧૫.૦૦	૧૯-૨-૨૦૧૭ ૧૫.૦૦

ઉક્ત સંવર્ગોની લેખિત પરીક્ષાના કોલેટર ડાઉનલોડ સંબંધિત પુછપરછ અંગે સમિતિના કંટ્રોલ રૂમના ફોન નંબર ૦૨૮૩ ૨-૨૫૧૧૫૦ ઉપર કચેરી સમય (૧૦.૩૦ થી ૧૮.૧૦ સુધી) દરમ્યાન(જાહેર રજા સિવાય) કરી શકાશે.

જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય , તેમ છતાં કોઈ કારણોસર કોલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ અને ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ભુજ-કચ્છની કચેરી ખાતે જે તે પરીક્ષાની તારીખથી પાંચ દિવસ અગાઉ રૂબરૂ સંપર્ક કરવો.

ખાસ સુચના:-

ઉમેદવારોને તથા વાલીઓને અનુરોધ કરવામાં આવે છે કે , પરીક્ષા સંબંધી નાણાની માંગણી કરતા લેભાગુ તત્વોની વાતોમાં ફસાઈ ના જાય અને આવી બાબત ધ્યાને આવે તો તેઓ સામે પોલીસ કાર્યવાહી કરે તેવી વિનંતી છે.

સ્થળ:- જિલ્લા પંચાયત કચેરી ભુજ-કચ્છ

મુ.ભુજ-કચ્છ

સચિવ

તા.૨૪/૦૧/૨૦૧૭

જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ ભુજ-કચ્છ